https://archive.org/details/bk1156/page/n0/mode/1up

1977-07-18 -KKP Gyanti Reet Rivaj (1156)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

॥ ૐ ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ

ના

જ્ઞાતિ રીત રિવાજોને લગતા નિયમો

"આ નિયમોનું સાંગોપાંગ નિષ્ઠાપૂર્વક
પાલન કરવું એ આપણી સૌ જ્ઞાતિ
ભાઇ બહેનોની પવિત્ર ફરજ છે."

પ્રકાશક : શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પાટીદાર વિદ્યાર્થી ભવન,
નખત્રાણા (કચ્છ)

કિંમત ૦-૪૦ પૈસા

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1156/page/n2/mode/1up

1977-07-18 -KKP Gyanti Reet Rivaj (1156)

realpatidar.com

॥ ૐ ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ

ના

જ્ઞાતિ રીત રિવાજોને લગતા નિયમો

"આ નિયમોનું સાંગોપાંગ નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ આપણી સૌ જ્ઞાતિ ભાઇ બહેનોની પવિત્ર ફરજ છે."

પ્રકાશક : શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ
પાટીદાર વિદ્યાર્થી ભવન,
નખત્રાણા (કચ્છ)

કિંમત ૦-૪૦ પૈસા

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n4/mode/1up

realpatidar.com

નિવેદન

આપણી જ્ઞાતિના ભાઈ બહેનો કચ્છ, સાબરકાંઠા, ખેડા, પાલનપુર, જીલ્લાઓ તેમજ અન્ય પ્રાંતોમાં અને પરદેશમાં વસી રહ્યા છે જેની આવતી પેઢીઓનો જ્ઞાતિ સંબંધ બરાબર જળવાઈ રહે અને સમાજના દરેક રીત રીવાજોની સંપુર્ણ પણે એકવાયતા જળવાય તે માટે જન્મ, લગ્ન કે મરણ જેવા શુભાશુભ પ્રસંગોએ પાળવાના સામાજીક ધારાધોરણ અને રીત રીવાજો એક પ્રકારના થાય તે માટેનું પ્રથમ લેખીત બંધારણ તા. ૧૦-૫-'૬૦ના જ્ઞાતિના ખુલ્લા અધિવેશનમાં લગભગ વીસ હજાર ભાઈ બહેનોની હાજરીમાં સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતું.

આપણી જ્ઞાતિ દિન પ્રતિદિન વધુ સંગઠીત બને, પરસ્પર સહકારની ભાવના વધુ દ્રઢ બને, તેવા શુભ હેતુથી, અને પ્રથમ અધિવેશનમાં પસાર થયેલ રીત રીવાજોના નિયમોમાં સમયાનુસાર પરીવર્તન કરવા તેમજ નવા ઠરાવો કરવાની આવશ્યકતા જણાતાં જ્ઞાતિનું દ્વિતિય ખુલ્લુ અધિવેશન તા. ૨૨-૫-૧૯૭૭ને રવીવારના રાત્રે વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં કચ્છ, ગુજરાત અને દેશ પરદેશથી આવેલ લગભગ છત્રીસ હજાર ભાઈ બહેનોના હાજરીમાં મળેલ આ અધિવેશનમાં કચ્છના ગામેગામ અને ગુજરાતના કંપા તથા બહારથી આવેલ ૬૭૫ ખાસ પ્રતિનિધિઓ અને યુવક સંઘના ૪૬૦ પ્રતિનિધિઓ તથા ૨૦૦

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n5/mode/1up

realpatidar.com

મહિલા પ્રતિનિધિઓની બનેલ વિષય વિચારણીય સમિતિએ ખુબ જીણ-વટ ભરી વિચારણા બાદ અગાઉના નિયમોમાં આજની પરિસ્થિતીને અનુરૂપ સુધારા વધારા સાથે ઠરાવો કરેલ અને નવા ઠરાવો પણ થયેલ આ ઠરાવોને જ્ઞાતિના આ ખૂલ્લા અધિવેશનમાં સર્વાનુમતે પસાર કર-વામાં આવેલ.

આપણા આ રીત રીવાજોના ઠરાવો કરવાના મુખ્ય ઉદેશ્યો જેવા કે સમાજના ગરીબ, મધ્યમ કે શ્રીમંત સર્વે જ્ઞાતિજનોનો સામા-જીક વહેવારમાં એક વાયતા જળવાય, લેતી દેતીના નિયમો સામાન્યમાં સામાન્ય માણસને પણ પરવડે અને ખોટા ખર્ચમાં ઉતરવું ન પડે તેમજ દેશ પરદેશમાં વસ્તા આપણા જ્ઞાતિજનોની ધંધાકીય સગવડતા જળવાય વિ. બાબતોને લક્ષમાં રાખી ઠરાવો થયેલ છે.

આપણા ઠરાવો સામાન્ય રીત રીવાજોના છે પરંતુ ઠરાવ નં. ૧૩ છુટાછેડા સંબંધનો છે એક વખત સમજી વિચારીને જ્ઞાતી, કુટુંબ અને સગાં સબંધીઓની સાક્ષીએ લગ્ન ગ્રંથીથી જોડાયા પછી છુટા છેડા લેવા એ સામાજીક દુષણ ગણાય છે. છુટાછેડા બનાવ નજીવા નિવારી શકાય તેવા કારણોથી બને છે આ બાબતે સામા-જીક રીતે વધારે સક્રિય થવાની જરૂર છે દરેક કુટુંબના તથા ગામે ગામના કાર્યકર્તાઓ થોડુંક વધારે લક્ષ આપશે તો છુટાછેડાના કિસ્સાઓ ભાગ્યેજ થવા પામશે.

realpatidar.com

realpatidar.com

આપણા માટે ગૌરવનો વિષય ગણાય કે આપણા યુવકોએ અખિલ ભારતીય ધોરણે રચેલ યુવક સંઘે પોતાના બંધારણના ઉદ્દેશ પૈકીનો એક મુખ્ય ઉદ્દેશ સમાજના નિયમો અને રીત રીવાજોનું પાલન કરાવવું એ સ્વીકારેલ છે આથી યુવક શકિત સક્રિય થવાથી આપણા સમાજના દરેક પ્રકારના સંગઠન મજબુત થવામાં સહાયભૂત બનશે.

આ રીત રીવાજો અને ધારાધોરણનું બંધારણ આ સાથે રજુ કરવામાં આવેલ છે. તેનો અમલ સવંત ૨૦૩૩ના અષાઢ સુદ ૨ તા. ૧૭-૬-૧૯૭૭થી થાય તેમ નક્કી કરવામાં (અષાઢી નવું વર્ષ) આવેલ.

આ ધારાધોરણના બંધારણ મુજબ કચ્છ, ગુજરાત અને અન્ય સ્થળોએ વસતા દરેક કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈ-બહેનોએ પોતાની સામાજીક ફરજ સમજીને બંધારણ મુજબ વર્તવાનું છે.

દરેક ગામના આગેવાનોને વિનંતી કરવામાં આવે છે કે આ બંધારણનું ચૂસ્તપણે પાલન થાય તે માટે પોતાના ગામના લોકોને બંધારણનો ઉદ્દેશ અને તેના ફાયદાઓ સમજાવવા પ્રચાર સભાઓ યોજવી અને સમસ્ત જ્ઞાતિએ ઘડેલા આ ધારાધોરણને અમલમાં લાવવા માટે પુરતો સાથ અને સહકાર આપે એજ, અભ્યર્થના

આપનો,

વિદ્યાર્થી ભવન
નખત્રાણા,
તા. ૨૨-૫-૧૯૭૭

ખીમજી નાગજી પટેલ
પ્રમુખ, અ. ક. ક. પાટીદાર અધિવેશન
પ્રમુખ, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n7/mode/1up

realpatidar.com

શ્રી અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ

દ્વિતિય અધિવેશન

તા: ૨૨-૫-૭૭ના ખુલ્લા અધિવેશનમાં પસાર થયેલ ઠરાવો.

:: ઠ રા વો ::

ઠરાવ ૧ લો

જ્ઞાતિના રીત રીવાજોના ઠરાવો અંગે :-

અગાઉ તા. ૧૦-૫-૬૦ના રોજે મળેલ આપણી જ્ઞાતિ પરિષદના ખુલ્લા અધિવેશનમાં પસાર કરેલ જ્ઞાતિના રીત રીવાજોના ઠરાવો જેમાં અગીયાર વર્ષ બાદ તા. ૨૪-૫-૧૯૭૧ના રોજે જ્ઞાતિની મળેલ સામાન્ય સભામાં જરૂરી જણાતાં સુધારા વધારા કરવામાં આવેલ તે ઠરાવોમાં આજ તા. ૨૨-૫-૭૭ના રોજે રાત્રે ૯ કલાકે મળેલ જ્ઞાતિના દ્વિતિય ખુલ્લા અધિવેશનમાં સમયોચિત્ત જરૂરી સુધારા વધારા તેમજ નવા ઠરાવો કરવાની આથી જ્ઞાતી જન મંજુરી આપે છે.

ઠરાવ ૨ જો

બોલામણા સંબંધે

બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગે બાળકની માતાના સગા ભાઈઓ તથા કાકાઈ ભાઇઓએ જ માત્ર જવાનું રહેશે અન્ય કોઈએ જવાનું નહીં અને આવા પ્રસંગે એક ટાણાંથી વધુ કોઇએ રોકાવું નહીં.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n8/mode/1up

realpatidar.com

ઠરાવ ૩ જો

પછેડો આપવા સંબંધે

દિકરીને પહેલું બાળક જન્મે, ત્યારે તે નિમિતે પછેડો આપવા માટે દિકરીને પોતાને ઘેર બોલાવીને પછેડો આપવો. પછેડો આપવા માટે દિકરીના સાસરાને ઘેર જવું નહીં.

ઠરાવ ૪ થો

સગપણ કરવા સંબંધે

(અ) બાળકોનાં તદન નાની વયે સગપણ કરવાં નહીં. સગપણ કરવા માટે વય મર્યાદા નીચે મુજબ રહેશે.

(૧) છોકરાની વય ઓછામાં ઓછી ૧૮ વર્ષ
(૨) છોકરીની વય ઓછામાં ઓછી ૧૫ વર્ષ

(બ) સગપણ કરતી વખતે દીકરાના માવિત્રો નીચે મુજબની વસ્તુઓ આપવી.

(૧) સોપારી નંગ ૧
(૨) ટોપરાં અથવા નાળિયેર નંગ ૨
(૩) ગોળ અથવા સાકર કીલો ૧
(૪) રૂપિયો એક રોકડો

ઉપર જણાવ્યા સિવાય સગપણ કરતી વખતે પૈસાના કે બીજી કોઇપણ વસ્તુઓની લેતીદેતી કરવી નહીં.

(ક) સામ સામે સગપણ કરવાં નહીં.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n9/mode/1up

realpatidar.com

ઠરાવ ૫ મો

સગાઈ (ટીલાં) સબંધે

સગાઇ(ટીલાં) પ્રસંગે દીકરાના માવિત્રોએ નીચે મુજબની વસ્તુઓ આપવી.

(૧) સુતરાઉ ઓઢણી નંગ ૧
(૨) ગોળ અથવા સાકર કીલો ૧। (સવા)
(૩) રૂપિયો ૧–૨૫ (સવા) રોકડો
(૪) પગનાં સાંકળા જોડી ૧.
(૫) નાકની સળી નંગ ૧

આ પ્રસંગે ચાર જણે જવું અને એક ટાંણાથી વધારે રોકાવું નહીં.

ઠરાવ ૬ ઠ્ઠો

તહેવારોના લાગા સબંધે

સગપણ થયા પછીના આવતા પહેલા તહેવારે દિકરાના માવિત્રે રૂા. ૧-૦૦ (રૂા. એક) તથા ત્યાર પછીના તહેવારોએ પચાસ (૫૦) પૈસા દીકરાની વહુને મોકલવા.

નોંધ :– ઉપર જણાવ્યા મુજબના લાગા (સંપેતરૂં) દિવાળી, હોળી અને જન્માષ્ટમીના તહેવારોએજ મોકલવા.

ઠરાવ ૭ મો

લગ્ન લખવા સબંધે

(૧) લગ્ન લખતી વખતે કન્યા પક્ષે લગ્ન પત્રિકાના પુડામાં રૂા. ૧-૨૫ (સવા રૂપિયો) મુકવો.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n10/mode/1up

realpatidar.com

(૨) લગ્ન વધાવતી વખતે વર પક્ષે રૂા. ૧-૨૫ (રૂા. સવા) આપીને લગ્ન વધાવવું.

(૩) લગ્ન પત્રિકા વધાવવા લઈ જવા માટે કન્યા પક્ષ તરફથી બે માણસોએ વર પક્ષને ઘેર જવું અને તેઓએ એક ટાણું રોકાવું

ઠરાવ ૮ મો

લગ્ન [વિવાહ] સબંધે

૧ વર અને અણવર સિવાય જાનમાં ૨૫ માણસોએ જવું અનિવાર્ય સંજોગોમાં વધુમાં વધુ ૫૦ માણસો જાનમાં જઈ શકશે અને કન્યા પક્ષે જાનને એક ટાણું જમાડવી.

નોધ :- બહુ દુરથી આવનાર જાનને અનિવાર્ય સંજોગોમાં બે ટાણાં જમાડી શકાશે.

(૨) લગ્ન પ્રસંગે વર પક્ષે લાગા તરીકે નીચે મુજબ આપવાનું રહેશે.

(૧) વાચણાંના રૂા. ૨૦-૦૦ (વીસ)

(૨) પોખવાનો રૂા. ૧-૦૦

(૩) પડલાંના કપડાં પહેરી માથે હાથ ફેરવતી વખતે સાસુ સસરા તથા લાગ લેતા કુટુંબીઓએજ માથે હાથ ફેરવીને કન્યાને એક એક રુપિયો આપવો

(૪) ઉમિયા માતાજી ભેટના રૂા. ૫-૨૫ (સવા પાંચ)

(૫) મંદિરના ધર્માદાનાં લાગાના રૂા. ૫-૨૫ (સવા પાંચ)

(૬) લગ્ન વિધિ કરાવવાના બ્રાહ્મણને દક્ષિણાના રૂા. ૧૦-૦૦ (દસ) વર પક્ષ તરફથી તેમજ રૂા. ૫-૦૦ (પાંચ) કન્યા પક્ષ તરફથી આપવા.

(૭) ઢોલી તથા વાળંદને ગોળના રૂા. ૧૦-૦૦ (દસ) આપવા.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n11/mode/1up

realpatidar.com

(૩) તદુપરાંત લગ્ન પ્રસંગે નીચેની વસ્તુઓની લેવડ દેવડ કરવાની રહેશે.

(અ) વર પક્ષ તરફથી કન્યા પક્ષને નીચે મુજબ આપવાનું રહેશે.

(૧) દાંતની ખરખરી નં. ૧
(૨) કપડાં સુતરાઉ નં. ૩ (સાડી, પોલકું, અને ચણીયો),
(૩) પડલામાં કાંકણ મઢેલું નંગ ૧ અથવા ચીટી નંગ ૧
(૪) સાકર અથવા ગોળ કીલો ૧| (સવા)

(બ) કન્યા પક્ષ તરફથી વર પક્ષને નીચે મુજબ આપવાનું રહેશે.

(૧) જમાઈને રોકડા રૂા. ૨૫-૦૦ (પચીસ) (કપડાના બદલામાં)
(૨) વરના પિતાને રૂા. ૧૫-૦૦ (પંદર)
(૩) વરના માતાને રૂા. ૧૫-૦૦ (પંદર)
(૪) વરના દાદાને રૂા. ૫-૦૦ (પાંચ)
(૫) વરના દાદીને રૂા. ૫-૦૦ (પાંચ)
(૬) બાકીના કુટુંબી (કાકા-કાકી, જેઠ-જેઠાણી વિગેરે) દરેકને પહેરામણીના રૂપીઆ બે બે આપવા.
(૭) તાંબા પીતળની હેલને બદલે રૂા. ૧૦૦-૦૦ (એકસો) રોકડા આપવા.
(૮) થાળી નંગ ૧ અને વાટકો નંગ ૧

(૪) કન્યાદાનમાં કોઈએ વાસણો આપવા નહીં અને પોતાની શક્તિ મુજબ મર્યાદિત રોકડું આપવું અને તેની જાહેરાત કરવી નહીં.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n12/mode/1up

realpatidar.com

(૫) લગ્ન વિધિ થઈ ગયા બાદ કન્યા વરના ઉતારે જાય ત્યારે નવ વધૂનો ખોળો ભરવામાં વર પક્ષ તરફથી પતાસાં અથવા સાકર કીલો ૧૧ (સવા) આપવાના રહેશે અને નવ વધૂને હાથ ફેરવતી વખતે સાસુ સસરા સિવાય કોઈએ પૈસા આપવા નહીં. (આ પ્રસંગે કોઈ પણ જાતનો પ્રસાદ વહેંચવો નહીં.)

(૬) માંડવો વરસાવવાના લાગાનો ફઈબાને રૂ. ૧-૦૦ (એક) આપવો.

ઠરાવ ૯ મો

સમુહ લગ્ન સબંધે

(૧) આપણી જ્ઞાતિમાં લગ્નો દર વર્ષે અનુકુળતાએ થઇ શકશે.

(૨) કોઈ પણ ગામ કે કુટુંબ સમુહ લગ્ન (એક સાથે એકજ દિવસે લગ્ન) કરવા માગતા હોય તો કોઈપણ ગામમાં વરપક્ષવાળાએ વાંધો લેવો નહીં. આ સમુહ લગ્ન પ્રથાને કોઈપણ તોડવા પ્રયત્ન કરે તો તેને કુટુંબ તથા ગામ સમજાવે અને જો ન સમજે તો તેના સાથે અસહકાર કરવો એ સર્વે ભાઈઓની પવિત્ર ફરજ છે.

ઠરાવ ૧૦ મો

આણાં સબંધે

૧ પરણ્યા બાદ કન્યા લગભગ એક માસ સાસરાના ઘેર રહેશે અને વળતાં આણામાં પાંચ માણસોએ જવું. સંજોગોવસાત વધુમાં વધુ બાર માણસોએ જવું અને એક ટાણું રહેવું.

૨ લગ્ન થયા પછીની જન્માષ્ટમી પછી કન્યાને તેના સાસરાને ઘેર મોકલાવી આપવી (બીજા આણાં કરવા નહિ)

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n13/mode/1up

realpatidar.com

ઠરાવ ૧૧ મો

મામેરા સબંધે

૧ પહેલાં મામેરામાં ભાણેજાને વાઘાના કપડા વિગેરે તેમજ બહેન તથા બનેવીને કપડાની જોડ આપવી તે સિવાય બાકીનાઓને પહેરામણી બદલ દરેકને રૂા. ૨-૦૦ (બે રૂપિયા) રોકડા આપવા અને જમણ તેમજ દાગીના વિગેરે બદલ રોકડ રકમ વધુમાં વધુ એકંદર રૂા. ૫૦૦-૦૦ પાંચસો સુધીની આપવી તેથી વિશેષ આપવી નહીં તેમજ તે પછીના દરેક મામેરામાં ઉપર મુજબ કપડાંઓ તદઉપરાંત જમણ તથા દાગીનાઓ બદલ રોકડ રકમ એકંદર વધુમાં વધુ રૂા. ૨૦૦-૦૦ (બસો રુપિયા) સુધી આપવી.

૨ મામેરાંની વળતરમાં કાંઈપણ કપડું કે રોકડ આપવી નહીં. તેમજ મામેરું બેઠું ભરવું અને તેની જાહેરાત કરવી નહીં અને મામેરામાં માણસોએ મર્યાદીત જવું.

ઠરાવ ૧૨ મો

પુનઃલગ્ન સબંધે

૧ કોઈપણ કન્યા વિધવા બને અથવા છૂટાછેડાના રીવાજ મુજબ છૂટાછેડા કરવામાં આવે તેનુ પુનઃલગ્ન કરી શકાશે.

૨ આવા પુનઃ લગ્ન સગપણ કરતી વખતે વર પક્ષ તરફથી રૂા. ૨-૦૦ બે રૂપીયા ફેરવવાના આપવાના રહેશે અને સગપણ નક્કી થયા બાદએ બે રૂપિયા પ્રસાદી માટે આપવાના રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n14/mode/1up

realpatidar.com

૩ આવા પુનઃલગ્નમાં વર અને અણવર સિવાય ૧૫ પંદર માણસો એ જવું અને એક ટાણું જમવાનું રહેશે આ પુનઃલગ્ન નિમિતે ચોખાના જમણના રૂ. ૧૦-૦૦ દસ તથા પુનઃલગ્નના જમણ (ખીચડી)ના રૂ. ૬૦-૦૦ સાઠ રુપિયા વર પક્ષે આપવાના રહેશે.

૪ તદઉપરાંત વર પક્ષે નીચે મુજબ કપડાં તથા દાગીના આપવાના રહેશે.

(૧) સુતરાઉ કાપડની જોડ (કન્યા માટે).
(૨) નાકની સળીહેમની નંગ ૧.
(૩) મદેલું કાંકણ નંગ ૧
(૪) પગના સાંકળાં જોડી ૧.

આ ઉપરાંત દાગીના કે રોકડ રકમ કાંઈ પણ આપવું નહિ.

૫ પાછા પગનાં આણામાં કન્યાપક્ષ તરફથી પાંચ માણસોએ જવું આ આણાંનાં બે ટાણાં રહેશે.

ઠરાવ ૧૩ મો

છૂટા છેડા સબંધે

૧ એક વખત સમજી વિચારીને લગ્ન ગ્રંથીથી જોડાયા બાદ છૂટા છેડા લઈ શકાશે નહિ પરંતુ પતિ પત્નિમાંથી કોઈપણ એક હિન્દુ કાયદા મુજબ ખોડ ખાંપણ વાળું હોય ત્યારે જ્ઞાતિની સંમતિથી છૂટા છેડા લઇ શકશે.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n15/mode/1up

realpatidar.com

૨ સમાજના કોઈ પણ ભાઈએ એક પત્નિની હયાતિમાં બીજી પત્નિ કરવી નહિ કાનુનના ઓથે રહી "રખાત" નામનું કલંકિત દુષણ અપનાવી શકશે નહિ આવા નિંદિત કાર્ય કરશે અથવા કરવામાં જે કોઈ સાથ સહકાર આપશે તેઓ પણ સામાજીક ગુનાને પાત્ર ગણાશે આ કાર્ય કરનાર અને કરાવનાર પાસેથી સમાજ જરૂરી ખુલાસાઓ મેળવશે અને તે અંગે સમાજના નિર્ણયની અવગણના કરનારની સાથે કોઈ પણ પ્રકારનો સામાજીક વ્યવહાર રાખવો નહિ (અસહકાર કરવો) અને જ્ઞાતિના કોઈ પણ સંગઠન કે સંસ્થાઓના સભ્ય પદેથી દુર કરવા જોઈએ આવા દુષણો ન થાય તે માટે કુટુંબ, પાંખડી કે ગામના કાર્યકર્તાઓએ સંપુર્ણ પણે તકેદારી રાખવાની રહેશે.

નોંધ :– છૂટા છેડા લીધેલ કે મેળવેલને કુવારી કન્યા આપવી નહીં.

ઠરાવ ૧૪ મો

મરણ પછીના ખર્ચ (દાડો) સબંધે

૧ મરનાર વ્યકિત પાછળ કોઈએ ખર્ચ (દાડો) કરવો નહીં.

૨ બારમાની વિધી પુરી કરી બ્રાહ્મણો – નિશાણીઓ, કે ગરીબોને પોતાની શક્તિ અનુસાર જમાડવા.

૩ મરનાર વ્યક્તિ પાછળ તેના સ્મરણાર્થે કોઇ રકમ આપવા માગતા હોય તો તેઓને સમાજના કેળવણી ફંડમાં, હોસ્પીટલ ફંડમાં

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n16/mode/1up

realpatidar.com

અથવા એવા સામાજીક ઉન્નતિના કાર્યોમાં તે રકમ આપવા આ અધિવેશન ખાસ ભલામણ કરે છે.

ઠરાવ ૧૫ મો

કુદરતી ઘર ભંગ થાય તે સબંધે

૧ દીકરીને સાસરાને ઘેર મોકલ્યા પછી મૃત્યુ પામે તો દીકરીને જીવીત સમય દરમ્યાન આપેલ દાનની કોઈ પણ વસ્તુ પાછી લેવી નહીં.

૨ જમાઈનું મૃત્યુ થાય અને તેવા પ્રસંગે દીકરીનાં માવિત્રો તે દીકરીને ત્યાંથી લઈ જવા માગતાં હોય તો દીકરીનાં માવિત્રોએ આપેલ દાગીના સિવાય બીજુ કાંઇ પાછું લઈ જઈ શકશે નહિ પરંતુ તે દીકરીને બાળકો હોય અને તે દીકરીની સાથે ન લાવતાં ત્યાં છોડી આવવાના હોય તો તેવા પ્રસંગે દીકરીનાં માવિત્રોએ દીકરીને આપેલ દાગીના તથા અન્ય કોઇપણ વસ્તુ પાછી લઈ જઈ શકાશે નહીં.

ઠરાવ ૧૬ મો

શિક્ષણ સબંધે

આથી આ અધિવેશન જ્ઞાતિજનોને ખાસ ભલામણ કરે છે કે આ પ્રગતિશીલ યુગને અનુસરી સૌ પોતાનાં બાળકો (પુત્ર તથા પુત્રીઓ) ને ઉચ્ચ શિક્ષણ ફરજીયાત અપાવે, તથા જે કોઈ પોતાના

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n17/mode/1up

realpatidar.com

બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની ધગશ ધરાવનારને સમાજ અત્યંત ઉત્સાહ આપે છે અને તેની કદર કરે છે

ઠરાવ ૧૭ મો

લગ્ન વિધી બાબત

દરેક ગામ, કંપાઓ તેમજ અન્ય સ્થળેએ લગ્ન વિધી અંગેની બ્રાહ્મણોની પદ્ધતિ અલગ અલગ હોય છે તેમાં અલગ અલગ પદ્ધતિના કારણે મનદુઃખ ન થાય તે માટે ખાસ રીતો વિધીઓ નક્કી કરી તેની પુસ્તીકાઓ છપાવી બહાર પાડવા નક્કી કરેલ છે તો સૌ જ્ઞાતિજનોએ તે મુજબની વિધીથી લગ્ન (વિવાહ) થાય તેવો સૌએ આગ્રહ રાખવાનો રહેશે.

ઠરાવ ૧૮ મો

બાહ્ય આચરણો અંગે

જ્ઞાતિમાં સંપૂર્ણ એકવાયતા જળવાય તે માટે કચ્છ, ગુજરાત, અને ભારત તેમજ વિદેશોમાં વસ્તા આપણા સમાજનાં જ્ઞાતિજનોએ જન્મથી મરણોતર સુધીના સંસ્કારો હિન્દુ રીત રીવાજો મુજબ પાળવા (આચરવા)ના રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n18/mode/1up

1977-07-18 -KKP Gyanti Reet Rivaj (1156)

realpatidar.com

આ રીત રીવાજો અને ધારા ધોરણના બંધારણનું ચુસ્તપણે પાલન કરવા સૌ ભાઇ બહેનોને પુનઃ હાર્દિક વિનંતી કરવામાં આવે છે.

જય ઉમિયાજી.

લી.

અષાઢી બીજ
શા. ૨૦૩૩

ખીમજી નાગજી પટેલ (માસ્તર)
પ્રમુખ,

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n19/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n20/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1156/page/n21/mode/1up

realpatidar.com

સમાજ પ્રત્યે....

જે કુટુંબમાં કૌટુમ્બિક જવાબદારી વિષે કોઇ એમ કહેવા લાગે કે મારે શું ? એ કુટુંબનું ખંડન નિશ્ચિત માનજો, જે સમાજમાં વ્યક્તિઓ પોતાનુ સામાજીક કર્તવ્ય બજાવતી નથી તે સમાજ નીચેજ જશે. કીડી અને મધ-માખી જેવા તુચ્છ ગણાતા જીવડા પણ સહકારી ધોરણે રહે છે. અને તેમાં કોઇ પોતાની ફરજ ચૂકતું નથી જે ચૂકે છે તે જીવવાનું અધિકારી નથી રહેતું. કુટુંબ સમાજ અને રાષ્ટ્ર સહકારી ધોરણે જ સુગઠીત રહી શકે અને સહકારી પ્રવૃત્તિ વ્યકિતગત ફરજની અદાકારી પર નિર્ભર છે.

— શ્રી

અનુપમ પ્રિન્ટર્સ, લાલ ટેકરી, ભુજ.

realpatidar.com